



RAN-2408000602030001

F.Y.B.Com. (Sem. - II) Examination November - 2025

Economics : Minor - Managerial Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) જમણી બાજુના અંક પ્રશ્નના પુરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate full marks of the questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ)

(10)

1. પૂર્ણ હરિકાઈમાં પેઢીની સમતુલાનો અર્થ સ્પષ્ટ કરો.
2. ઈજારાનો અર્થ શું છે?
3. વેચાણ ખર્ચ એટલે શું?
4. આંતરિક વળતર દર પદ્ધતિ એટલે શું?
5. વાસ્તવિક વેતનની વ્યાખ્યા આપો.
6. કિંમત નેતૃત્વ આવશ્યક શરતો જણાવો.
7. હિસાબી નફો અને આર્થિક નફો વચ્ચેનો તફાવત જણાવો.

પ્ર. 2. ઈજારાયુક્ત હરિકાઈમાં ટૂંકાગાળામાં પેઢી અને લાંબાગાળામાં જૂથની સમતુલાની સ્થિતિ આકૃતિની મદદથી સમજાવો

(14)

અથવા

પ્ર. 2. અ. કિંમત ભેદભાવ એટલે શું? કિંમત ભેદભાવના પ્રકારો સમજાવો.

(07)

બ. પૂર્ણ હરિકાઈમાં પેઢીની ટૂંકાગાળાની સમતુલા આકૃતિની મદદથી સમજાવો.

(07)

પ્ર. 3. મૂડી અંદાજપત્રનો અર્થ આપો. મૂડી પૂરવઠાના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરો.

(14)

અથવા

પ્ર. 3. અ. વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો.

(07)

બ. “નફો એ અનિશ્ચિતતા વહોરવા માટેનો બદલો છે” - સમજાવો.

(07)

પ્ર. 4. ટૂંકનોંધ લખો (કોઈપણ બે)

(12)

1. પૂર્ણ હરિકાઈમાં ઉદ્યોગની સમતુલા
2. અલ્પહસ્તક ઈજારાનાં લક્ષણો
3. મૂડીરોકાણનો પરત ચૂકવણીનો ગાળો
4. નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in brief. (Any Five) (10)**
1. Clarify the meaning of equilibrium of a firm under perfect competition.
 2. What is meant by monopoly?
 3. What is selling cost?
 4. What is internal rate of return method?
 5. Give the definition of real wages.
 6. State the essential conditions of price leadership.
 7. Mention the difference between accounting profit and economic profit.
- Q. 2. Explain with the help of diagram the short run equilibrium of a firm and long run equilibrium of group under monopolistic competition. (14)**
- OR**
- (A) What is meant by price discrimination? Explain the types of discrimination. (07)
- (B) Explain with the help of diagram the short run equilibrium of a firm under perfect competition. (07)
- Q. 3. Give the meaning of capital budgeting. Discuss the internal and external sources of obtaining capital funds. (14)**
- OR**
- (A) Discuss the factors affecting real wages. (07)
- (B) "Profit as reward for uncertainty bearing" - Explain. (07)
- Q. 4. Write short notes: (Any Two) (12)**
1. Industry equilibrium under the perfect competition
 2. Characteristics of oligopoly competition
 3. Pay-back period of capital investment
 4. Innovation theory of profit.
-